

## WRWWO CELEBRATES DIWALI WITH PATIENTS OF JAGJIVAN RAM HOSPITAL



Smt. Tanuja Kansal - President of Western Railway Women Welfare Organization (WRWWO). Doctors and staff of JRH, Mumbai Central with fruits gifted by WRWWO for the patients.

Ahmedabad, Western Railway Women Welfare Organization (WRWWO) has always rendered unconditional help for the welfare of railway employees and their families. Under the leadership of Smt. Tanuja Kansal - President of WRWWO, many such noble

works have been undertaken over Western Railway. In yet another example of this kind gesture, WRWWO has made generous donations to Western Railway's Jagjivan Ram Hospital for the benefit of the patients.

According to a press

## ZEES &amp; Zindagi announce a series 'Qatil Haseenaon Ke Naam'

Ahmedabad, Women have often been celebrated for being an epitome of patience, sacrifice, endurance and more. ZEES and Zindagi are set to break this stereotype and unearth their unapologetic side in the upcoming original 'Qatil Haseenaon Ke Naam'. A desi noir anthology, Qatil Haseenaon Ke Naam is helmed by critically acclaimed British Indian director Meenu Gaur. The series features an eclectic cast with leading actors from the subcontinent including Ahsan Khan, Osman Khalid Butt, Sheheryar Munawar, Saleem Miraj, Samiya Mumtaz, Sanam Saeed, Sarwat Gilani, Mehar Bano, Faiza Gilani, Beo Raana Zafar and Eman Suleman.



Written by Farhad Nabi and Meenu Gaur, 'Qatil Haseenaon Ke Naam' is set in the timeless lanes of 'Andon Sheher' - a mythical neighborhood and showcases stories of love, lust, power, and redemption woven in a web of betrayal, angst, and revenge. Each story from the anthology depicts the fearlessness of

women and their determination to avenge deceit. At the core of the stories is mystery, suspense, intrigue with twist endings. Manish Kalra, Chief Business Officer, ZEES India said, "At ZEES, we are passionate about bringing you stories that reflect a myriad of emotions from across genres and storylines. Qatil Haseenaon Ke Naam is a unique and invigorating show which portrays a never seen before side of female protagonists who challenge stereotypes. (19-8)

## METRO BRANDS OPENS ITS 600th FLAGSHIP STORE



Ahmedabad, Metro Brands, India's leading speciality footwear and accessories retailer, having presence across 134 cities spread across 29 states and union territories in India, announced the opening of its landmark 600th flagship store nationally in the tech-city of Bengaluru, India. The new store under the brand name 'Metro' is located at Lulu Global Mall, Gopalpura, Bengaluru, which is a high-end shopping district in the city.

Spread across an area of 1,300-square feet, the multi-brand outlet will retail contemporary shoe brands like Do Vinchi, Skechers, ID, Fitflop and Crocs. The store will also offer a wide variety of economy, mid-range and premium footwear and accessories. The store also showcases fresh and exciting looks for casual and formal footwear and accessories, for both men and women. Commenting on Metro Brands store opening in Bengaluru, Nissan Joseph, Chief Executive Officer, Metro Brands, said: "We are delighted to announce the launch of our 600th store, which is also the 36th store of Metro Brands and the 14th store of the brand Metro in Bengaluru. -

## Tata Motors partners with Bank of India to offer a financing scheme

Ahmedabad, In a constant endeavor to make ownership of cars an easy process for customers and adding to the celebrations of this festive season, Tata Motors, India's leading automotive manufacturer, has signed a retail finance MoU with Bank of India (BOI), one of India's leading nationalised banks, to offer exciting finance options to all its passenger vehicle customers. As part of the tie-up, BOI will provide loans to Tata Motors' customers at an interest rate starting from as low as 6.85%. This scheme will offer a maximum of 90% financing on the total cost of the vehicle (Ex-showroom price + Insurance + Registration). Customers can also enjoy a benefit of a special EMI option starting with Rs. 1502/- per lakh on a 7-year repayment period. The Bank has also designed certain exclusive features for Tata

Motor's car buyers availing BOI car finance option which includes Zero processing charges till 31st March 2022, FOIR (Fixed Obligation to Income Ratio) basis which the current liabilities of the customer applying for loan will be capped at 70% irrespective of the income slab and a Higher loan amount eligibility for purchasing Tata Cars.. These offers will be applicable on the New Forever range of the ICE Cars and SUVs as well as on EVs for personal segways buyers across the country. Commenting on the association, Mr. Rajan Amba, Vice President, Sales, Marketing & Customer Care, Passenger Vehicle Business Unit, Tata Motors said, "We, at Tata Motors, have always tried to make our personal mobility solutions more affordable and accessible for individuals and families at beneficial rates. (20-4)

gesture and shared their happiness on the joyous day. Chief Medical Officer, Director of Western Railway and Medical Director of JRH also expressed their heartfelt gratitude towards Smt Tanuja Kansal - President of WRWWO for her kind gesture. These gifts received from WRWWO, were distributed by Dr



Gifts received from WRWWO were distributed to the inpatients at Jagjivan Ram Hospital, Mumbai Central on the occasion of Diwali.

Hafizunnisa - Medical Director of Jagjivan Ram Hospital & her team of senior doctors.

## Wadhvani Foundation and Frontier Markets announce a strategic partnership

Ahmedabad, Wadhvani Foundation and Wadhvani Catalyst Fund today announced a strategic partnership with Frontier Markets to empower and support up to 10,000 women in rural India over two and half years by helping them to earn income independently. Speaking on the funding decision, Sanjay Shah, Founder and CEO, Frontier Markets, said, "We are extremely excited about partnering with Wadhvani Foundation and the Wadhvani Catalyst Fund as they validate our mantra that investing in rural women is smart business and the key to driving SDG goals at scale. This partnership - also becomes one of the first to showcase how blended capital can be leveraged to support social businesses and help drive accelerated scale." (19-10)

by building an army of rural women salesforce (or Sahelis), armed with smartphones and deep consumer insight. They are driving change, creating an impact while managing to make money and profits. We certainly look forward to leveraging the Wadhvani ecosystem to help them grow their network and touch more lives." Ajanta Shah, Founder and CEO, Wadhvani Foundation - India/SEA, said, "Wadhvani Foundation is excited to partner with Frontier Markets. From selling only clean energy and agri products in 2011, they have managed to add multiple categories, including consumer durables products and essential services, by leveraging their social commerce platform and by simply listening to the pulse of rural consumers. Frontier Markets is changing the way villages buy products and services, and the way business is done across the hinterland

## Security in J&amp;K has deteriorated: Mehbooba

Chandigarh, Former J&K chief minister Mehbooba Mufti on Tuesday said that security situation in J&K has deteriorated following the fresh killings in Srinagar in the last two days. On Monday evening, militants had gunned down a Kashmiri salesman in the old city area of Srinagar, the second targeted killing in Jammu and Kashmir. PDP president Mehbooba Mufti said, "Security situation in J&K has deteriorated to an extent where not a week goes by when an innocent doesn't lose his life. Unfortunately that despite repressive measures taken in name of security, people are being killed & have no sense of dignity or normalcy. Condolences to his family," Mehbooba Mufti said in a tweet. The police on Saturday night had said that unidentified gunmen fired on Mohammad Ibrahim Khan in the Bohri Kadal area of Srinagar, a resident of Bandipore, worked in the dry fruit shop of Roshan Lal Mawa, a Kashmiri Pandit businessman who returned to the Valley in 2018 and set up his business. On Sunday night, militants had killed a 29-year-old police constable, Tawseef Ahmad Wani, in the Batamaloo area. This is the 13th targeted killing in Kashmir since October 1, including those of five non-local labourers. Multiple gunfights broke out during operations by security forces to identify those responsible for the attacks. Of the 11 people killed in October, seven were in Srinagar. After the fresh two killings, the security around the city has been further beefed up. Fresh checking points have been established in the city. Unfortunately that despite repressive measures taken in name of security, people are being killed & have no sense of dignity or normalcy. Condolences to his family," Mehbooba Mufti said in a tweet.

Reg. Office: 3rd Floor, Saty Complex, Opp. IOC Petrol Pump, 1321 Ring Road, Satellite, Ahmedabad - 380015. E-mail: cs@lipisystems.com. Phone: 079-26750600

Website: www.lipisystems.com CIN: L21004GUP0000292

NOTICE OF POSTAL BALLOT AND E-VOTING INFORMATION

Pursuant to Section 108, 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013, (the "Act"), read with Rule 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014, (the "Rules") and Ministry of Corporate Affairs (MCA), General Circular No. 14/2020 dated 8 April, 2020, General Circular No. 17/2020 dated 13 April, 2020 read with General Circular No. 20/2020 dated 15 June, 2020, General Circular No. 30/2020 dated 26 September, 2020 and General Circular No. 36/2020 dated 21 December, 2020 and General Circular No. 10/2021 dated 23 June, 2021 (hereinafter known as MCA Circulars) and Regulation 44 of the SEBI (LODR) Regulations, 2015 (hereinafter known as SEBI Circulars) and/or as may be amended or modified from time to time, the Board of Directors of the Company has decided to convene a Postal Ballot process, which is hereby given that the Shareholders as set out in the Notice of Postal Ballot dated 09 November, 2021 ("Notice") for seeking approval of Shareholders of the Company are proposed to be passed as a Special Resolution by the Shareholders of the Company by means of Postal Ballot voting by electronic means only (i.e. remote e-voting only). The members are further hereby informed that:

- 1. DISPATCH:**
  - In compliance with the aforementioned MCA Circulars, Electronic copies of the Notice along with explanatory statement have been sent to all the members whose E-Mail IDs are registered with the Company or the Registrar and Share Transfer Agent (the "RTA"), i.e. M/s. Camco Corporate Services Limited as per the Register of Members dated 09 November, 2021 for seeking approval on agenda item forms part of the Notice by means of Remote e-voting only.
  - A printable copy of the Notice shall also be made available on the website of the Company www.lipisystems.com, on the website of SEBI Limited www.sebiindia.com and on the website of MCA, at www.mca21.com as per the provisions of the Companies Act, 2013. The dispatch via E-Mail was completed on Wednesday, 10<sup>th</sup> November, 2021 in accordance with applicable laws.
  - Members may please hereby note that the physical copy of the Notice along with Postal Ballot Forms and pre-paid business envelopes shall not be sent to the shareholders for this Postal Ballot as the same has been dispensed via MCA Circulars and that all communication of shareholders for or against the proposal will only take place through the remote e-voting system only. Further, for the purpose of updation of the correct and valid details more specifically the E-mail ID, members who have not registered their email ID or KYC details or members who want to update the same are requested to send request to the Company at cs@lipisystems.com.
- 2. E-VOTING:**
  - Pursuant to Section 108 of the Companies Act, 2013, read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended by the Companies (Management and Administration) Amendment Rules, 2015, and pursuant to Regulation 44 of SEBI (LODR) Regulations, 2015, Member holding shares either in Physical form or in Dematerialized form, as on the cut-off date of Friday, 09<sup>th</sup> November, 2021, may cast their vote through the e-voting system (E-Voting) on the Special Business as set out in the Notice, as per the e-voting instructions detailed in the Notice. The Company has availed E-Voting Services from Central Depository Limited (India) Limited (CDSL) as per the details labeled below.

Date and time of Commencement of Remote e-Voting Period	Thursday, 11 <sup>th</sup> November, 2021 (09.00 AM IST)
Date and time of End of Remote e-Voting Period	Friday, 10 <sup>th</sup> December, 2021 (05.00 PM IST)
Cut-off date for determining the eligibility of members to vote through electronic means	Friday, 09 <sup>th</sup> November, 2021
Scrutinizer to the E-Voting Process	M/s. Kunal Sharma & Associates, Practising Company Secretary, Ahmedabad. E-mail: sksharma@ksa.com
Contact Details for Redressal of grievances connected with Remote e-Voting:	Members having any technical issue in login can contact CDSL, helpdesk by sending a request at helpdesk@cdslindia.com or by email at 022-23058738 and 022-23058542-43.
Log-in type - Individual Shareholders holding securities in Demat mode with NSDL.	Members having any technical issue in login can contact NSDL, helpdesk by sending a request at helpdesk@nsdlindia.com or by email at 022-23058738 and 022-23058542-43.
Log-in type - Individual Shareholders holding securities in Demat mode with NSDL.	Members having any technical issue in login can contact NSDL, helpdesk by sending a request at helpdesk@nsdlindia.com or by email at 022-23058738 and 022-23058542-43.

3. GENERAL INFORMATION: The members are requested to note that:

- On the vote on a resolution is cast, the shareholders shall not be allowed to change it subsequently or cast vote again. The remote e-voting module shall be disabled at 5.00 pm on 10<sup>th</sup> December, 2021 and e-voting shall be disabled beyond the same.
- Those Shareholders whose E-Mail ID is not registered with the depositories for obtaining login credentials for e-voting for the resolutions proposed in this Notice are requested to submit the following through their registered E-Mail ID to the respective E-Mail IDs of the Company/RTA:
  - For Physical Shares: Name of Shareholder, Folio No., scanned copy of the Share Certificate (front and back), self-attested scanned copy of PAN Card & AADHAR Card.
  - For Dematerialized Shares: Name of Shareholder, Demat Account Details (CDSL-16 digit beneficiary ID or NSDL-16 digit DP ID - Client ID), Client Master Report, Consolidated Demat Account Statement, Self-attested scanned copy of PAN Card & AADHAR Card. On receipt of the requests as above, the Company/RTA shall coordinate with CDSL and provide the login credentials to the members.
- Resolutions passed by the Members through postal ballot is deemed to have been passed as if they have been passed at the General Meeting of the Members of the Company and the last date of E-Voting Period, i.e. Friday, 10<sup>th</sup> December, 2021 (05.00 PM IST) shall be construed as the date on which the resolutions would be deemed to have been passed. If approved by the Shareholders of the Company, the results of e-voting will be declared on or before Sunday, 12<sup>th</sup> December, 2021.
- In case of any other queries members may write an E-Mail to "cs@lipisystems.com" or may contact through the contact details as mentioned in the Notice of Postal Ballot.

For and On Behalf of the Board of Directors  
Lipici Systems Limited  
Sd/-  
Mr. Kunal Nandani Agrawal  
Whole Time Director  
Date: 10<sup>th</sup> November, 2021  
Place: Ahmedabad, Gujarat  
DIN: 00168241

## Punjab AG issue: Congress MP Manish Tewari takes dig at Sidhu

Chandigarh, Anandpur Sahib Congress MP Manish Tewari on Wednesday took a dig at the Punjab government's decision to replace advocate general APS Deol, saying that politicising the AG's office undermines the integrity of constitutional functionalities. In three tweets, Tewari said that both previous advocate generals of Punjab became "punching bags in proxy political wars." "Those who subvert the institution of the AG's office need to remember a lawyer is neither wedded to a client or a brief," he posted on Twitter without naming Punjab Congress chief Navjot Singh Sidhu. The Charanjit Singh Channi government on Tuesday accepted the resignation of AG APS Deol, who had put in his

papers on November 1 amid repeated statements from Sidhu against him. Taking a shot at Channi, former Punjab Congress president Sunil Jakhar said that the AG's ouster has exposed a compromised chief minister. "The ouster of a competent yet 'allegedly' compromised officer has exposed a really compromised CM. Giving rise to a pertinent question - Whose government is it Anyway? (\*Apologies to BBC's radio drama - Whose line is it Anyway)," he tweeted.

As a lawyer, Deol had represented former director

general of police (DGP) Sumedh Singh Saini, who headed the state police at the time of the sacrilege incidents in 2015 and the subsequent police firing on protesters. Sidhu was opposed to Deol's appointment for this reason and kept pressing for his replacement. Channi finally gave in and agreed to appoint a new AG. In another tweet, Tewari said since @PunjabGovtIndia is going to appoint a new advocate general, they would be well advised to peruse rules of professional standards prescribed by @barcouncilindia.

## ExxonMobil Lubricants India renews endorsement deals with Neeraj Chopra



Ahmedabad, ExxonMobil Lubricants Pvt Ltd announced today the renewal of its brand ambassador association with the Tokyo Olympics medalists - Neeraj Chopra, Mirabai Chanu, and Bajrang Punia- for Mobil India. The announcement was made during a gala felicitation ceremony at New Delhi in the presence of the company's top retailers.

Tokyo 2020 was India's most successful Olympic campaign with a tally of seven medals. While Neeraj Chopra became the first track & field athlete and the second Indian to win an individual Gold medal, Mirabai Chanu the first Indian weightlifter to win a Silver. Bajrang Punia, who won a Bronze at the event, is the only Indian wrestler to win

three medals at the World Wrestling Championships. A common thread among these sports persons is that they symbolize a powerful story of transformation, rising from humble beginnings to representing India at the Olympics.

Commenting on the development, Deepankar Banerjee, CEO, ExxonMobil Lubricants, said, "We feel extremely proud to renew our brand association with Neeraj Chopra, Mirabai Chanu and Bajrang Punia. Our engagement with them began before they achieved world fame, and hence it gives us immense pleasure to see them become the very best in their respective fields, winning major titles and medals at the Olympics. (20-4)

## PUBLIC NOTICE

Registered office: ICICI Bank Towers, Bandra-Kurla Complex, Bandra (East), Mumbai - 400051

Corporate Office: ICICI HFC Tower, JB Nagar, Andheri Kurla Road, Andheri East, Mumbai - 400059

Branch Office: 1st floor, Shakti Business Avenue, Above United Bank, Mehansahighway, Mehansahighway - 384002

The following borrowers have defaulted in the repayment of principal and interest of the loans facility obtained by them from ICICI Home Finance Company Limited ("ICICI HFC") and the loans have been classified as Non-Performing Assets (NPA). An NPA was issued to them under Section 13(2) of Securitisation and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act-2002 on their last known addresses, however it was not served and hence they are hereby notified by way of this public notice.

Sr. No.	Name of the Borrower/ Co-Borrower/ Guarantor/ (Loan Account Number) & Address	Property Address of Secured Asset / Asset to be Enforced	Date of Notice Sent/ Outstanding as on Date of Notice	NPA Date
1.	Bhaveshgiri Vilasgiri Gosai (Borrower), Kishanben Bhaveshgiri Gosai (Co-Borrower), 89 Raj Nagar Society TB Three Kasta Patan Patan Patan - 384265/ LHPA000120697	Plot No 99 Patan- 384265	28-09-2021	06/08/ Rs. 2021

The steps are being taken for substituted service of notice. The above borrower's and/or their guarantors (as applicable) are advised to make the payments of outstanding within period of 60 days from the date of publication of this notice else further steps will be taken as per the provisions of Securitization and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002.

Date: November 11, 2021  
Place: Mehansahighway

Authorized Officer  
ICICI Home Finance Company Limited

## PRAVEG COMMUNICATIONS (INDIA) LIMITED

(Formerly Sord and Sheld Pharma Limited in which Praveg Communications Limited has amalgamated)

Praveg Regd. Office: 214 Athena Avenue, Behind Jagu Showroom, S.C. Highway, Gota, Ahmedabad - 382481

Phone: +91 79 27496737 | Website: www.praveg.com | E-mail: cs@praveg.com

Extract of Unaudited Consolidated Financial Results for the quarter and half year ended September 30, 2021 (Rs. in lakhs, except per share data)

Particulars	Quarter ended 30/09/2021	Half Year ended 30/09/2021	Quarter ended 30/09/2020
Revenue from Operations	891.34	1254.52	341.45
Profit before exceptional items and tax	226.34	278.19	59.94
Profit before tax	226.34	278.19	59.94
Profit for the period	169.35	207.96	46.33
Total Comprehensive Income (after tax)	169.34	207.96	46.33
Paid up Equity Share Capital (of Rs. 10 each)	1848.41	1848.41	1848.41
Other Equity excluding revaluation reserve	-	-	-
Earnings per equity share (of Rs. 10 each)	-	-	-
Basic and Diluted (Not Annualised)	0.92	1.13	0.25

Note: The Audit Committee has reviewed the above results and the Board of Directors has approved the above results at their respective meetings held on November 10, 2021. The Statutory Auditors of the Company have carried out a Limited Review of the aforesaid results.

Additional information on Unaudited Standalone Financial Results is as follows:

Particulars	Quarter ended 30/09/2021	Half Year ended 30/09/2021	Quarter ended 30/09/2020
Revenue from Operations	891.34	1254.52	336.95
Profit before exceptional items and tax	226.35	278.19	55.50
Profit before tax	226.35	278.19	55.50
Profit for the period	169.35	208.14	41.88
Total Comprehensive Income (after tax)	169.35	208.14	41.88
Paid up Equity Share Capital (of Rs. 10 each)	1848.41	1848.41	1848.41
Other Equity excluding revaluation reserve	-	-	-
Earnings per equity share (of Rs. 10 each)	-	-	-
Basic and Diluted (Not Annualised)	0.92	1.13	0.23

3 The above is an extract of the detailed format of the standalone and consolidated financial results for the quarter and half year ended September 30, 2021 filed with the Stock Exchange pursuant to Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

4 The full format of the standalone and consolidated financial results for the quarter and half year ended September 30, 2021 are available on the Stock Exchange website (www.sebiindia.com) and the Company's website www.praveg.com.

For Praveg Communications (India) Limited  
Sd/-  
Parasakumar Patel  
Managing Director  
Place: Ahmedabad  
Date: November 10, 2021



